



અનદીસવા ફૂટબોલ નાયક

**Andiswa Soccer Star**

 Eden Daniels

 Eden Daniels

 Darshan Soni


 2

 ગુજરાતી gu / English en

અનદીસવાએ જોયું કે છોકરાઓ ફૂટબોલ રમતા હતા. તેને પણ રમવું હતું. તેને ગુરુ ને પૂછ્યું કે એ પણ રમી શકે?

...

Andiswa watched the boys play soccer. She wished that she could join them. She asked the coach if she can practise with them.



गुरुअे हाथे कुब्जे पर राषुा अने कीधुं के "आ नलशाणे ढाली  
छोकराओ कुटडोल रमी शके".

...

The coach put his hands on his hips. "At this school, only boys are allowed to play soccer," he said.

છોકરાઓ એ કીધું કે તે નેટબોલ રમવા જાયે. તેઓએ કીધું કે  
નેટબોલ છોકરું માટે હોય અને ફૂટબોલ છોકરાઓ માટે.  
અનદીસવા તો ગુસે થઈ ગયી.


...

The boys told her to go play netball. They said  
that netball is for girls and soccer is for boys.  
Andiswa was upset.

આવતા દિવસે એક મોટો ફૂટબોલ મેચ હતો. ગુરુ ને વાંધો હતો કારણ કે તેનો શ્રેષ્ઠ ખેલાડી બીમાર હતો અને રમી નતો શકતો.

...


The next day, the school had a big soccer match. The coach was worried because his best player was sick and could not play.



અનદીસવાએ ગુરુ પાસે ભાગ્યઈ અને માંગ્યું કે તે એને રમવા દીયે. ગુરુ પેચ માં હતો. પછી, તે અનદીસવાને રમવા દીધી.

...

Andiswa ran to the coach and begged him to let her to play. The coach was not sure what to do. Then he decided that Andiswa could join the team.



મેચ મુશ્કેલ હતો. અર્ધો સમય પર કોઈ એ ગોલ નતો માર્યો.

...

The game was tough. Nobody had scored a goal by half time.

બીજો અર્ધો સમય માં એક છોકરો એ અનદીસવા ને દડો પાસ કર્યું. તે જલ્દી થી ગોલ આગર ગયી. દડો ને જોશથી માર્યું અને ગોલ ઘનયો.

...

During the second half of the match one of the boys passed the ball to Andiswa. She moved very fast towards the goal post. She kicked the ball hard and scored a goal.



જોનાતો નાયવા મંડ્યા. તે દિવસ થિ નિશાળના છોકરુને ફૂટબોલ રમવાની રજા છે.

...

The crowd went wild with joy. Since that day, girls were also allowed to play soccer at the school.




# Global Storybooks


[globalstorybooks.net](http://globalstorybooks.net)

અનદીસવા ફૂટબોલ નાયક

## Andiswa Soccer Star

 Eden Daniels

 Eden Daniels

 Darshan Soni (gu)

